


મહાગ્રંથ ભગવદ્ગોમંડલ ઓનલાઈન



‘સવાલ ભાષાની ગ્રોસ્પેરિટી (ભાષાની સમૃદ્ધિ)નો છે, સર્વઈલનો નહિં’, ‘૨૦૫૦માં એ જ ભાષા શુદ્ધિત રેઝ્રો જેણું કમ્પ્યુટરાઈઝેશન થયેલું હશે’, ‘ગુજરાતી ભાષાની બાબતમાં પણ ગુજરાત વાઈબ્રન્ટ બનવું જોઈએ...’ - આ શબ્દો એક એવા યુવાનના છે જેણે આપણી માતૃભાષાને


આગામી પેઢીઓ સુધી અને આગામી સહીઓ સુધી જીવંત રાખવા માટે બીજું જરૂરું છે. આમ તો ગુજરાતી ભાષાને દુનિયાના કોઈપણ ખૂબુંમાં રેતા ગુજરાતીઓ સુધી પહોંચાડવા માટે અનેક લોકોએ અનેક રીતના પ્રયાસો કર્યા છે એની તો નોંધ લેવી પે જ, પરંતુ અશોક કરણિયા નામનો યુવક અને તેમની એવી જ યુવા ટીમે દુમણાં જે કામ કર્યું છે તે ખરેખર અસાધારણ છે. અલભત, અશોકભાઈ અને તેમની ટીમના પ્રેરણાસ્થોત, ચાલકબળ, ગુરુ - જે કોઈ વિશેષણથી નવાજો તે છે રતિલાલ ચંદ્રિયા. હા, એ જ જેમણે ગુજરાતી ભાષાની પહુલી ડિજિટલ ડિક્ષનરી - ગુજરાતી લેક્સિકન - આપણાને સૌને ઉપલબ્ધ કરાવી એ ચંદ્રિયા.

ભગવદ્ગોમંડલને ઓનલાઈન મુકનારી ટીમ : મહેનતા દાદ માગી લે એવી છે



અંત:પ્રવેશીખૂણો

અંત:	ખૂણુપણી	બાંદરાં	અંત:
[અ. અંતર (અંત) + પ્રવેશીન (દાખલ કરણાર) + કોઇ (ખૂણો)]	૫	(નહિયત) આકૃતિની અંતર જીતો ખૂણો; ને કાટાનુણાથી મોટો અને ચાર કાટાનુણાથી નાનો ખૂણો; પ્રવેશીન કોઇ; ડિબ્લેક્સ અનેત.	૫



આકૃતિ કચણનમાં કલટ ખૂણો અંત:પ્રવેશીખૂણો છે.

જે લોકો પોતાની માતૃભાષા ગુજરાતીને ચાહે છે તેમના માટે તો ભગવદ્ગોમંડલ શાખાકોશ જરાય અજીવિયો નથી, પરંતુ એ સિવાય એવા લાખો ગુજરાતીઓ અને અનેક યુવકો તેના વિશે જાણતા ના હોય તે સ્વાભાવિક છે. આજના વેંતિયા રાજકારણીઓ તમામ સુવિધાઓ અને ઓતો ઉપલબ્ધ હોવા છતાં ભાષા માટે જે કામ નથી કરતા એ કામ છેક ૧૮મી સહીમાં એટલે કે ૧૮૬૫માં રાજવી પરિવારમાં જન્મેલા ભગવતસિંહજીએ કરી બતાવ્યું હતું. અને હવે એ વિશાળ શાખાકોશને એક વચોવૃક્ષ વિલિક વેપારી અને તેમની યુવાન ટીમે ડિજિટલ સ્વરૂપમાં દુનિયા સમસ્ક પ્રસ્તુત કર્યો છે. આ વિશે જીતો વર્લ્ડ સાથે વાતચીત કરતા અશોકભાઈ જણાવે છે કે, ગુજરાતી ઔનલાઈન ડિક્ષનરી

gujaratilexicon.comના પ્રણેતા રતિલાલ ચંદ્રિયાએ ભગવદ્ગોમંડલને પણ ડિજિટલ સ્વરૂપમાં મૂકવા માટે પરવાનગી લેવા ગોડલ નગર પાલિકાનો સંપર્ક સાધ્યો અને પાલિકાએ તે માટે મંજુરી પણ આપી દીધી. ત્યાર પછી ૧૮ એપ્રિલ ૨૦૦૮ના રોજ શરૂ કરેલી કામગીરી અમે ૧૮ ફેબ્રુઆરી ૨૦૦૮ના રોજ પૂરી કરી દીધી હતી એટલે કે દસથી અગ્નિયાર મહિનાના ટૂંકું

શું છે ભગવદ્ગોમંડલ?


આજે ગુજરાતી વિશ્વકોશ એટલે કે ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલા જેનસાઈકલોપીડિયાથી ચણાખરા લોકો વકેક હશે, તો એ સંદર્ભમાં ભગવદ્ગોમંડલ વિશે સાવ સરળ રીતે કહેવું હોય તો કહી શકાય કે તે ગુજરાતી ભાષાનો પહેલો વિશ્વકોશ હતો. અત્યાર સુધી સામાન્ય વ્યવહારમાં ભગવદ્ગોમંડલને ગુજરાતી શબ્દકોશ તરીકે જ ઓળખાવવામાં આવે છે પરંતુ ગોડલના રાજવી ભગવદસિંહજી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ગ્રંથને જેનસાઈકલોપીડિયા એટલે કે વિશ્વકોશ કહી શકાય. ડેમકે ૮૨૭૦ પાનાંના આ મહાગ્રંથમાં ૨,૮૧,૩૭૭ શબ્દો છે અને તેના ૮,૨૧,૮૨૩ અથો આપવામાં આવ્યા છે. ઉપરાંત તેમાં ૨૮,૧૫૬ તો રૂઢિપ્રયોગો છે.

આ મહાગ્રંથની રૂચનાનો ઈતિહાસ પણ એટલો જ રોમાંચક છે. ૧૮૬૫ની ૨૪મી ઑક્ટોબરે જન્મેલા ભગવતસિંહજીને બાળપણથી જ ગુજરાતી ભાષા પ્રત્યે ભારે લગાવ હતો અને ઉંમર વધવા સાથે એ લગાવ વધુ મજબૂત અને પરિપક્વ બન્યો. સરકારી દ્રષ્ટાને અને આદાલતો વગેરે જગ્યાએ અંગેજ ભાષાએ કરેલી ધૂસરાખોરી સામે ગુજરાતી ભાષાને યોગ્ય મહત્વ મળે અને તેનો વધુમાં વધુ ઉપયોગ થાય તે દિશામાં તેમણે વિચારવાનું શરૂ કર્યું અને ૧૮૧૫ના અરસામાં તેમણે નવા નવા શબ્દોનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું. આ માટે તેમણે પ્રમાણભૂત ગ્રંથો,

પુસ્તકો, સાહિત્યનાં પુસ્તકો, વર્તમાનપત્રો, સામચિકો, જાહેરખબરો, નાટક-સિનેમાનાં ચોપાનિયાં જેવા અનેક સોતો જોવાનું અને તેમાંથી લોકો સુધી પહોંચાડવા માટે જરૂરી લાગે એવા શબ્દો અલગ તારખાં. આ પછી ૧૮૮૮ની પહેલી ઑક્ટોબરે તેમણે ગોડલમાં ભગવદ્ગોમંડલની અલગ ઓફિસ જ શરૂ કરી. ત્યાં સુધીમાં તેમણે આશરે ૨૦,૦૦૦ શબ્દો એકટા કરી લીધા હતા અને તેના ઉપર કામ કરતા કરતા ૨૫ ઓંગસ્ટ ૧૯૪૪ના રોજ ૬૦૨ પાનાંનો પ્રથમ અંક પ્રકાશિત કર્યો. આ પછી નિયમિત સમયાંતરે તેમણે બીજા અંકો પ્રકાશિત કરવાનું ચાલુ રાખ્યું. ગુજરાતી ભાષાના આ પહેલા જેનસાઈકલોપીડિયાનો છેલ્લો અને નવમો અંક નવ માર્ય ૧૮૫૫ના રોજ પ્રકાશિત થયો હતો. આ ૨૬ વર્ષ (આમ કુલ ૪૦ વર્ષ)ની મહેનત બાદ તેમણે જે નવ ભાગ પ્રકાશિત કર્યા તેની પાછળ એ જમાનામાં લગભગ સાડા પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ગ્રંથોની કિમત તે સમયે રૂ. ૫૪૫ હતી પરંતુ રાજ્યાશ્રયને કરાણે તે રૂ. ૧૪૬માં મળતા હતા. માત્ર એ જમાનામાં જ નહિ પરંતુ આજે પણ ગુજરાતી ભાષાના ચાહકો, સાહિત્યકારો, શિક્ષણકારો અને અન્ય વિદ્યારોને ત્યાં ભગવદ્ગોમંડલનો સેટ હોય તે ભારે ગૌરવની વાત ગણાય છે, અને હવે તો બદલાયેલા સમય સાથે આ મહાગ્રંથ અને તેનો અમૃત્ય ખજાનો મારા-તમારા કમ્પ્યુટર સુધી આવી પડેંદ્યો છે.



રતિલાલ ચંદ્રિયા:
પ્રોજેક્ટના મણીતા



ગાળામાં જ અમે ભગવદ્ગોમંડલના ૮૦૦૦ કરતાં વધુ પાનાંની ટેટા એન્ટ્રી, મૂક રીઠિંગ, જરૂરી સુધારા-વધારા બધું જ પૂર્ણ કરીને આ મહાકોશને અમે ઑનલાઈન મૂકવા માટે સરજ થઈ ગયા હતા.

ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે રસ-રૂચિ ધરાવતા અશોકભાઈ આમ તો મેનેટ ટેકનોલોજીઝ નામે મુખ્યન્યે ગુજરાતી સોફ્ટવેર તૈયાર કરતી કંપનીના સર્વેસર્વ છે ભગવદ્ગોમંડલના ડિજિટલીકરણ દ્વારા ગુજરાતી ભાષા પ્રત્યે જે નિષ્ઠા બતાવી છે તે દાદ માગી લે એવી છે. ઑનલાઈન ગુજરાતી ડિક્શનરી ગુજરાતી લેક્સિકોનાના લોકાર્પણ વખતે આપણા અગ્રાહી સાહિત્યકાર અને ગુજરાતી વિશ્વકોશના મુખ્ય સંપાદક શ્રી ધીરુભાઈ કાકે કહ્યું હતું કે, આ કામ તો ખરેખર ગુજરાતમાં થવું જોઈતું

હતું. (ગુજરાતી લેક્સિકોન સાઈટ લંડનમાં તૈયાર થઈ હતી) ધીરુભાઈની એ રચનાત્મક ટકોને યાદ કરીને આઈએ એ વાતનો ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભગવદ્ગોમંડલનું સમગ્ર કામ અમદાવાદમાં થયું છે અને તેમાં અશોકભાઈ ઉપરાંત કાર્ટિક મિશ્રી, સુમેયા વોરા, પલક શાહ, પદ્મ જાધવ, મૈત્રી શાહ, જાગૃતિ દેસાઈ, શ્રુતિ અમીન, વિવિ પંચા, પાયલ ધરણીધર, મિહિર ગાંધી, સમય ભાવસાર જે વી યુવા ટીમે કરેલી સંનિષ્ઠ મહેનત www.Bhagwadgomandal.comમાં જોઈ શકાય છે. ગુજરાતી ભાષા સાથે છેડજાડ કરનારા અનેક લોકો છે અને ઊંઝા જોડણીના નામે એક વિકૃત ગતકું ઊભું કરનારા પણ છે, છતાં રતિલાલભાઈ, અશોકભાઈ અને તેમની ટીમે ગુજરાતી લેક્સિકોન તેમજ ભગવદ્ગોમંડલની વેબસાઈટ

આ શબ્દો

પગર

પગરખું

પગરખો

પગરચા

પગરખેણું

પગરથી

પગરના

પગરટ

પગરસ્ત

પગરટો

પગરો

પગરટો

પગર

પગરાગ

પગરી


પગરખું



ક્રમાંક	વ્યુટ્પસ્તિ	દિનાંગા	અર્થ
	[સં. પાદ (પગ) + ખું (યાવખું); પાદસ્ક્રા-પાયખું-પાયખાં]	ન.	પગખું રક્ષણ કરે એથું ચામડાનું છૂં મોઝું; ખાસંકુ; મોજાંડી; જોડો; ચાલતાં પગખું રક્ષણ થાય એવી ચામડાની બનાવણ; કાંચખું; ઉપાન. ઘસાઈંગ્યેલા જોડા ખાસડા કે પગખાં કહેવાય. ખાસંકુ તિરસ્કારાંઓ કે કોણમાં બોલતાં વપરાય છે.

વધુ -

પગરખામાં પગ ધાલવો મુહૂરો = નરોબની કરવી; હરીફાઈકરવી; સરસાઈકરવી; એલેલી સરસ થવાની તજવીજ કરવી; ચકસાયકરી કરવી.



અશોક કરણિયા

‘ભગવદ્ગોમન્ડલમાં ઘણા શબ્દો એવા છે જેના એક સાથે અનેક અર્થ આપવામાં આવ્યા હોય, તેની સાથે જોડાયેલા રૂદ્ધિપ્રયોગો પણ આપવામાં આવ્યા હોય, અન્ય માહિતી અને ચિત્રો પણ હોય, તેની સાથે જોડાયેલા રૂદ્ધિપ્રયોગો પણ આપવામાં આવ્યા હોય, અન્ય માહિતી અને ચિત્રો પણ હોય જેને અમારે યથાવત રીતે વેબ એડિશનમાં મૂકવા પડે. કેટલાક શબ્દો તો એવા છે જેના અર્થ અને સમજૂતી છ-છ પાનાં ભરીને હોય.’

ટેકનોસાવી અથવા કઢો કે નેટ સાવી લોકોમાં હવે આંનલાઇન ડિક્ષનની ગુજરાતી લેક્સિકોન લોકપિય થઈ રહી છે અને અનેકો લોકો રોજેરોજ તેનો ઉપયોગ કરે છે, પરંતુ હવે તેમાં મહત્વની વાત એ છે કે બાળકોને પણ ગુજરાતી ભાષા અને શુદ્ધ જોડાયીમાં રસ પેડ અને તેઓ શીખી શકે તે માટે ગુજરાતી ભાષાના શબ્દોની રમતો અને પદલસનો વિભાગ રાખવામાં આવ્યો છે. આ ગેમ્સ અને પદલ મોટા લોકો રેખે તો તેમને પણ નવા અથૻં અને શબ્દો અને રૂદ્ધિપ્રયોગો જાણવા મળી શકે. અશોકભાઈની ટીમની બીજી એક નોંધપાત્ર કામગીરી ઉત્કર્ષ નામની સંપૂર્ણ ગુજરાતી ઓપરેટિંગ સિસ્ટમ છે. થોડાં વર્ષ પહેલાં એક પ્રકાશકે ગુજરાતીમાં કમ્પ્યુટર શીખવા માટે એક સીરી તૈયાર કરી હતી, પરંતુ ઉત્કર્ષ gujaratilexicon.com ઓપરેટિંગ સિસ્ટમ તો આંનલાઇન જ આ મદદ કરે છે જેને પરિણામે અંગ્રેજી ભાષાના ઉદ્યોગી અથવા તો ઉમર થઈ ગઈ હોવાથી હવે અંગ્રેજી શીખવાનો રસ ના હોય તેવા ગુજરાતી ઉમરલાયક વરીલો માટે આ ગુજરાતી ઓપરેટિંગ સિસ્ટમ સાચા અર્થમાં આશીર્વાદ સમાન થઈ શકે તેમ છે.